

## પૂર્વીંય પ્રાકૃતોના એક તર્ફથત પ્રત્યય વિશે

—એ પ્રત્યયની પૂર્વે રહેલા હુસ્ત સ્વરનો દીવ્ય સ્વરમાં ફેરફાર એ અંગ્રે. માન્જની અને અશોકકાલીન પૂર્વ ભારતની જાળાની એક વિશેષ લાક્ષણ્યકતા છે.

પ્રા. નલિની બલખીર (પેરિસ, ફ્રાંસ) પોતાના એક સંશોધનલેખમાં ('Morphological evidence for dialectal variety in Jaina Māharāṣṭri', Dialectes dans les littératures indo-arye-

gnes' ૧૯૮૬, પેરિસ-એ પુરસ્કરમાં પ્રકાશિત) જણાવે છે કે આગમ-નિર્ણયિતા ('આચારાંગ'), 'દ્વાર્ષીકાલિક' અને 'ઓધ')—સાહિત્યની ભાપોમાં, સંસ્કૃતના તુલના-વાયક પ્રત્યય—તરં-નું સ્વાર્થીક પ્રત્યય—ક-લાગીને કે—તરક—એમું ડ્રેપ થાય છે, તે—તરાગ—ડ્રેપ મળે છે. એટલે કે પૂર્વવતીં ફુર્સ્ટ સ્વર હાઈ સ્વરમાં બદલાઈને પ્રયોગદેલો મળે છે. જેમ કે વિપુલતરાગો, અનતરાગો, મૂઢાગો, સુહૃત્તાગો વગેરે. એ ક્રેખ ઉપરની ટિપ્પણીમાં તેમણે (૧) અશોકના પૂર્ણ ભારતના શિલાલેખોમાં, (૨) 'ભગવતી-સૂત્ર' નેવા અર્ધમાગધી આગમથિયમાં, તથા (૩) સંસ્કૃત નાટક 'મુખ્યકટિક'માં આવતા પાત્ર શક્તારની ભાવામાં આવા જ અયોગો (-આક-, -ઇક-, -જક-) ભળતા હોવાનો નિર્દેશ ક્રમરાઃ એચ. રસુડર્સ, એ. વેલર અને પિશેલને આધારે કર્યો છે.

આ ઉપરથી રૂપ્યએ થાય છે કે પ્રાચીન અર્ધમાગધી ભાપાના મૂળિયાં છેક અશોકાલીન પૂર્ણી ભારતની ભાવા સુધી પહોંચે છે, અને અર્ધમાગધીની અસુક વિશેષિતાઓ નિર્ણયિતાઓની ભાવામાં પણ જિતરી આવી છે.

ઉપર્યુક્ત ટિપ્પણે અતુર્ધ્ર પ્રયોગોના શૈલાંક ઉદ્ઘારણું નીચે પ્રમાણે છે :

૧. અશોકના શિલાલેખ : ચિલાતીક, ચિલાભિતીક, લગ્રહ.
૨. 'ભગવતીસૂત્ર' : ખુદ્ગામ ।
૩. અર્ધમાગધી આગમથિયમાં અન્યત્ર : સુહૃત્તાગ ('આચારાંગ'), વિલાગ- (વિટક) ('સંસ્કૃતાંગ'), અનાઇય ('સ્થાનાંગ', 'પ્રશ્ન વ્યાકરણુ', 'સાતાધર્મકથા,')
૪. 'મુખ્યકટિક' : ચાલુદન્તાક, વાસુદેવાક, પુત્રાક.

કે. આર. ચંદ્ર

\*

### સંખ્યાક ભૂતકૃદંતનો પ્રત્યય ઇડ

હેમચન્દ્રાચારેં ગોતાના પ્રાકૃત વ્યાકરણમાં (૮.૪.૪૩૬) — ઇડ પ્રત્યય અપદ્રશ ભાવાના સંખ્યાક ભૂતકૃદંતના પ્રત્યય તરીકે નોંધો છે. પિશેલ હેમચન્દ્રને ટાંકાને કહે છે કે (૬ પણ્ઠ) કે મળે એ હેત્વાયક પ્રત્યય છે, એનો પ્રયોગ સા. ભૂ. ઇ. માટે થયો છે. ડૉ. મ. વિ. તગારે પ્રમાણે ('હિસ્ટોરિકલ આર્થિક અપદ્રશ', પૃ. ૧૫૧) પણિભી અપદ્રશના ૧૧ મા—૧૨ મા સેકાની દૃતિઓમાં એનો અત્યલ્પ પ્રયોગ જોવા મળે છે.

સ્વર્યાંશુ અને પુષ્પહંતની અપભંશ કૃતિઓમાં આ પ્રત્યય જોવા મળ્યો નથી. પરંતુ અમારા અધ્યયન પ્રમાણે એના પ્રયોગો 'વસ્તુદેવહિંડી' (પ્ર. ૪૬૩. અધ્યમ અંશ)માં મળે છે. અમુક જગ્યાએ આ પ્રત્યય ભૂતકૃદંત અથવા તો સં. ભૂ. કૃ. ના અર્થમાં પણ લઈ શકાય છે, અતાં અમુક જગ્યાએ તો -હરવાળું' ૩૫ સ્પષ્ટપણે સં. ભૂ. કૃદંત હેવાનું 'જગ્યાણું' પડે તેમ છે. બંને પ્રકારનાં ઉદાહરણ નાચે આપ્યાં છે.

### ૧. બંને પ્રકારના અર્થની સંલાઘનાથાળાં પ્રયોગો :

- (૧) નારદો ઉરખધાઉ ગગણુપહેણુ વિજનીહરગઢિય પતો ય મેહકૂડ. (૫. ૬૩, પ. ૧૭)
- (૨) હેવો ય તરફિમ હરએ અભિજાઉ ઉપધકો ગગણુદેસ'. (૫. ૧૧૫. પ. ૨૫)

### ૨. સ્પષ્ટપણે સં. ભૂ. કૃ. ના પ્રયોગો :

- (અ) ...તિ પલલિદુઉ સુએં ડિનો. ('એમ બોલીને ચોપટ બોલી ગયો.' (૫. ૧૦૫, પ. ૧૨)
  - (અ) આદ્યોસિય' નારઞ્ચેણુ મહયા સહેણુ.....સુપિણી ઢીસઠ, દંશેદજ અથ' સહિ તિ. (૫. ૬૬, પ. ૧૬)
- ('રહમિણુનુ' અપહરણ થઈ રહ્યું છે, બળ વાપરીને (તેને) રોકો—અવરોધો')

ડૉ. આલ્ડોઇના 'વસ્તુદેવહિંડી'ની લાપા પરના લેખમાં આ પ્રત્યયની નોંધ લેવાઈ નથી. ('ખુલેટિન ચોંબ ધ રફુલ ચોંબ એરિયેન્ટલ એન્ડ એફિક્ન સ્ટડીઝ', ૮, ૩૧૬ અને પછીનાં)

અશોકના શિલાલેખોમાં, લંકાના એક અભિલેખમાં અને બીજી સંરકૃતમાં હેત્યાંક કૃદંતના -તુ-પ્રત્યયનું-તુ ઇથી સંબંધક ભૂતકૃદંતના અર્થમાં વપરાયેલું જોવા મળે છે. અપભંશ સાહિત્યમાં પણ -તુ પ્રત્યય સં. ભૂ. કૃદંતના અર્થમાં પ્રમુકતા થયો જ છે.

સંબંધક ભૂતકૃદંતના -તું અથવા તો-તું નો-તું અને પછી -તુ એવી રીતે વિકાસ થયો હોય એમ પણ માનવામાં કોઈ બાધા નથી. અર્થાત્ એનું

આજુ -તું અને બીજુ આજુ -તુણ આ બન્નેનું -તુ ત્યે પરિવર્તન થયું અને હેતુથીડ તથા સં. ભૂ. કૃ. એકદ્વિતીય થઈ ગયાં. બન્ને પ્રત્યયો લાગતા પહેલાં ધાતુમાં ઇકાર ઉમેરાય જ છે. એટલે - ઇડં (-ઇતું) અને - ઊળ, -ઇઊગ (-ઇતુગ) અને છે. તગારે જે એવો મુલાસો આપે છે કે સંસ્કૃત સં. ભૂ. કૃ. ના -ય ધરથી -ઇય, પણી -ઇઅ અને પણી -ઇડ થયો એ આ વિચારખૂના પ્રકાશમાં રીકાર્ય બનતું નથી.

આ ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે એક આજુ હેતુથી કૃદંતનો પ્રત્યય -ઇડં નો અત્ય અનુસ્વાર લુખેલ થઈ ને -ઇડ બન્યો. બીજુ આજુ સં. ભૂ. કૃ. ના પ્રત્યય -તુણનો -ઊળ, પણી -ઉળ, -ં (-ઇડં) અને -ઇડ એ રીતે વિકાસ થયો. એમ બન્ને પ્રત્યયો એક બીજા સાથે લગ્યા ગયા. પ્રાકૃત સાહિત્યમાં અત્યયના સીથી જૂના પ્રયોગ 'વસ્તુદેવહિંડી'માં આપણું મળે છે. પ્રાચીન ગુજરાતી-રાજસ્થાનીમાં સં. ભૂ. કૃ. ના પ્રત્યય -ઇડ છે, જેના ધરથી અવા. ગુજરાતાં -ં પ્રત્યય ડિતરી આવ્યો છે. \*